

ઈસ્લામિઝમ વચ્ચે પાકિસ્તાન હાલ ફસાઈ ગયું છે

- આઈ.આઈ.ટી. ગાંધીનગર ખાતે વ્યાખ્યાનમાળાનું આયોજન કરવામાં આવ્યું

- ક્રિસ્ટોફે જોફેલ્ટે પાકિસ્તાનની કરન્ટ સમસ્યા પર લેકચર આપ્યું

પાકિસ્તાન હાલ ત્રણ મેજર પ્રોબલમનો સામનો કરી રહ્યો છે. તેમાં જોવા જઈએ તો ઈસ્લામ રાષ્ટ્ર, લોકશાહી કે સરમુખત્યારશાહી અને ત્રીજું ભાષાવાદનો ઉદય આવા પ્રોબલમના કારણે પાકિસ્તાન વિકાસથી દુર જઈ રહ્યો છે. જેના પરિણામે ઈસ્લામિઝમ વચ્ચે પાકિસ્તાન ફસાઈ ગયું છે. આ શબ્દો છે ફાન્સના પોલિટિકલ એક્સપર્ટ ક્રિસ્ટોફ જોફેલ્ટના જેમણે આઈ.આઈ.ટી. ગાંધીનગર ખાતે યોજાયેલા વ્યાખ્યાનમાળામાં આ વાત કહી હતી.

ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, ગાંધીનગર ખાતે વ્યાખ્યાનમાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ફાન્સથી આવેલા પોલિટિકલ એક્સપર્ટ ક્રિસ્ટોફ જોફેલ્ટે પોતાની બૂક ઘ પેરડાઈસ ઈનસ્ટેબિલીટી એન્ડ રેસિલિએન્સ (પાકિસ્તાન વિરોધાભાષ, અસ્થિરતા અને સ્થિતિસ્થાપકતા) લખવાની દરમ્યાન કરેલા અનુભવના આધારે પાકિસ્તાનની રાજકીય પરિસ્થિતિ અને સમસ્યા પર ઈન્ટસ્ટીંગ વાત કરી હતી.

ક્રિસ્ટોફ જોફેલ્ટે વધુમાં જણાવતા કહ્યું કે ભલે પાકિસ્તાન લોકશાહી બનવાની દિશામાં આગળ વધી રહ્યું હોય પણ ઘણા ખરા પાકિસ્તાની હજુ પણ લોકશાહી નથી ઈચ્છતા તેઓ મિલિટરી શાસને પણ યોગ્ય ગણે છે. જેના પરિણામે વિરોધાભાસની પરિસ્થિતિનો ઉદ્ભવ થયો છે. વળી લોકશાહી અને મિલિટરી શાસન વચ્ચે અવાર-નવાર ઘર્ષણના બનાવો બને છે જેના પરિણામે લોકોમાં પણ એક પ્રકારનો રાજકીય અસ્થિરતાને લઈને ડર જોવા મળી રહ્યો છે.

ભારત ઉપર વાત કરતા તેમણે જણાવ્યું છે કે ૧૯૪૫ થી લઈને ૧૯૯૦ સુધીના સમયગાળામાં ભારતના રાજકીય ઇતિહાસમાં સાઇલન્ટ રિવોલ્યુશન થયું હતું દરેક ક્ષેત્રે કઈ ને કઈ ફેરફાર થઈ રહ્યા હતા. જેના પરિણામે ભારત સ્થિતિ સ્થાપક બની શક્યું ન હતું.

ઉલ્લેખનીય છે કે ભારત અને પાકિસ્તાનના ભાગલા બાદ પાકિસ્તાન સ્થિરતા સ્થાપવાના ઘણા પ્રયાસો કર્યો છે. પણ પહેલા બાંગ્લાદેશ અલગ દેશ બનતા તેને ત્યારથી લઈને અત્યાર સુધી સમયાંતરે ઘણા જટકા લાગ્યા છે.

પાકિસ્તાનની મુખ્ય સમસ્યાઓ

- * ઈસ્માલ રાષ્ટ્ર બનાવવું તો કયું? સિયા કે સુન્ની
- * અનેક ભાષાવાદ ફેલાવતા લોકોને પોલિટિક્સમાં વધારે પડતો હસ્તક્ષેપ કેમ અટકાવવો.
- * લોકશાહી રાષ્ટ્ર બનાવવું કે સરમુખત્યારશાહી રાષ્ટ્ર
- * મિલિટરી શાસન વચ્ચે લોકશાહી દબાઈ

